

Visit of H.E. Mr. Péter Szijjártó, Minister of Foreign Affairs & Trade (MFAT), Hungary to India (May 26-27 2022)

મહામહિમ શ્રી પીટર સિજ્જાર્ટોની મુલાકાત, વિદેશ અને વ્યાપાર મંત્રી, હંગેરીથી ભારત (મે 26-27 2022)

27 મે, 2022

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરના આમંત્રણ પર, હંગેરીના વિદેશ અને વેપાર મંત્રી શ્રી પીટર સિજ્જાર્ટો, 26-27 મે 2022 ના રોજ સત્તાવાર મુલાકાતે ભારત આવ્યા હતા. તેમની સાથે ઉચ્ચ સ્તરીય વ્યાપારી પ્રતિનિધિમંડળ પણ હતું.

2. ભારત અને હંગેરી પરસ્પર વિશ્વાસ અને સમજણ પર આધારિત હૂંફાળા અને ઐતિહાસિક સંબંધ ધરાવે છે. આપણાં દ્વિવપક્ષીય સંબંધો, સંસ્થાઓમાં, શિક્ષણમાં, સંસ્કૃતિમાં અને બન્ને દેશના લોકો વચ્ચેના પારસ્પારિક સંબંધોમાં બંધે જ મજબૂત કડીરૂપ બનેલ છે.

3. બન્ને મંત્રીઓએ, પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટોમાં, રાજકીય, આર્થિક, સાંસ્કૃતિક અને બન્ને દેશના લોકો વચ્ચેના પારસ્પારિક સંબંધો સહિત દ્વિવપક્ષીય સંબંધોની સમગ્ર શ્રેણીઓ પર ચર્ચા કરી હતી. વિદેશ મંત્રીશ્રી એ હંગેરિયન સરકારનો યુકેન - હંગેરી સરહદ પરથી 6000 થી વધુ ભારતીય નાગરિકોને સ્થળાંતર કરવાની સુવિધા આપવા બદલ અને હંગેરિયન યુનિવર્સિટીઓમાં સ્થળાંતર કરાવેલા ભારતીય તબીબી વિદ્યાર્થીઓને સમાવવાની તેમની ઓફર બદલ આભાર માન્યો હતો.

4. મંત્રીઓએ નોંધ્યું હતું કે દ્વિવપક્ષીય વેપાર US ડોલર 1 બિલિયનની નજીક પહોંચી રહ્યો છે અને હંગેરીમાં ભારતીય રોકાણ બધા જ ક્ષેત્રોમાં વધી રહ્યું છે. બન્ને પક્ષો પાણી, કૃષિ, ખાદ્ય પ્રક્રિયા, આરોગ્ય અને સાયન્સ અને ટેકનોલોજી સહિતના વિવિધ ક્ષેત્રોમાં વધુ તકો શોધવા માટે પણ સંમત થયા હતા. હંગેરિયન પક્ષે ઈન્ટરનેશનલ સોલર એલાયન્સ ફ્રેમવર્ક એગ્રીમેન્ટ પર પણ હસ્તાક્ષર કર્યાં.

5. બંને પક્ષોએ સાંસ્કૃતિક કડી અંગે પણ ચર્ચા કરી હતી અને 2023માં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી તેમજ રાજદૂવારી સંબંધોની સ્થાપનાના 75 વર્ષની ઉજવણીની ઉત્સાહપૂર્વક અપેક્ષા કરી હતી.

6. બંને પક્ષોએ વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ, ભારત-યુરોપીયન યુનિયન સંબંધોમાં વિકાસ, ઈન્ડો-પેસિફિક, અફઘાનિસ્તાન, શ્રીલંકા અને યુકેન પર પણ વિચારોનું આદાનપ્રદાન કર્યું.

7. ભારત-હંગેરી વ્યાપાર મંચ, જેની સહ-અધ્યક્ષતા વિદેશ મંત્રી સિજ્જટો અને શ્રીમતી મીનાકાશી લેખી, માનનીય વિદેશ રાજ્ય મંત્રી, જે 27 મે 2022 ના રોજ પણ યોજાઈ હતી, તેમાં બંને દેશોના વરિષ્ઠ વ્યાપારી અગ્રણીઓએ ભાગ લીધો હતો. બિઝનેસ ફોરમમાં બે વ્યાપારી કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. વિદેશ મંત્રી સિજ્જટોએ આવાસ અને શહેરી બાબતો અને પેટ્રોલિયમ અને કુદરતી ગેસના માનનીય મંત્રી શ્રી હરદીપ સિંગ પુરીને પણ મળ્યા હતા અને બંને દેશો વચ્ચે ઉર્જા ક્ષેત્રે સહકાર અંગે ચર્ચા કરી હતી.

નવી દિલ્હી

27 મે, 2022

DISCLAIMER: This is an approximate translation. The original is available in English on MEA's website and may be referred to as the official press release.